

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનના ઓટોમોટિવ ઉદ્યોગના ભવિષ્યની ચર્ચા કરવા માટે સીટી ઓફ બ્રેમ્પટન યોજે છે ઓટોમોટિવ ફોરમ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (23 ફેબ્રુઆરી 2022) – ગત સપ્તાહમાં સીટી ઓફ બ્રેમ્પટને બ્રેમ્પટનના ઓટોમોટિવ ઉદ્યોગની અગત્યતાની ચર્ચા કરવા માટે અને સરકારના તમામ સ્તરે સ્ટેલાન્ટિસ બ્રેમ્પટન એસેમ્બલિ પ્લાન્ટમાં (Stellantis Brampton Assembly Plant) રોકાણ કરવાની જરૂરિયાત અંગે જાગૃક્તા ઊભી કરવા બ્રેમ્પટન ઓટોમોટિવ ફોરમ હાથ ધર્યું.

ફોરમમાં બ્રેમ્પટન સીટી કાઉન્સિલના સભ્યો, ઈકોનોમિક ડેવેલપમેન્ટ સ્ટાફ, મંત્રીઓ, સ્થાનિક MP અને MPPઓએ હાજરી આપી જેમણે બ્રેમ્પટનના ઓટોમોટિવ ઉદ્યોગના ભવિષ્ય તેમજ બહોળા ધોરણે ઓન્ટારિયો અને કેનેડાના ઓટોમોટિવ ઉદ્યોગોની ચર્ચા કરી.

બ્રેમ્પટન ખાતેની સ્ટેલાન્ટિસ સુવિધા બ્રેમ્પટનના ઓટોમોટિવ ઉદ્યોગની ધરોહર છે અને તે આશરે 3,000 નિર્માણકારી રોજગારો પ્રદાન કરીને નોંધપાત્ર રીતે સ્થાનિક અર્થતંત્રને પ્રભાવિત કરે છે. તે આખા પ્રાંતમાં સપ્લાયરો, લોજિસ્ટિક્સ, અને ટૂલિંગ કંપનીઓ તેમજ HVAC અને વિદ્યુત કંપનીઓ સાથેના અનેક રોજગાર આડકતરી રીતે પ્રદાન કરે છે. એવો અંદાજ છે કે ઓટોમોટિવ ઉદ્યોગમાં દર એક રોજગાર દીઠ પાંચથી છ પરોક્ષ નોકરીઓ ઊભી થાય છે.

દરેક ઉદ્યોગમાં બ્રેમ્પટનનું ઉન્નત ઉત્પાદન ક્ષેત્ર સહયોગ અને ભાગીદારીઓનો પાયો છે. રોજગારને જોતા તે બ્રેમ્પટનનો સૌથી મોટો ઉદ્યોગ છે જેમાં લગભગ શહેરના ચોથા ભાગના કાર્યબળનો સમાવેશ થાય છે. બ્રેમ્પટનનું ઉન્નત ઉત્પાદન ક્ષેત્રનું 23 ટકા કાર્યબળ ઓટોમોટિવ ઉદ્યોગમાં છે.

બ્રેમ્પટનના ઓટોમોટિવ ઉદ્યોગ અને ઉન્નત ઉત્પાદન ક્ષેત્ર (Advanced Manufacturing sector) વિશે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો: www.investbrampton.ca.

હકિકતોનો ટૂંકસાર

- બ્રેમ્પટનની સ્ટેલાન્ટિસ સુવિધા તેમના વૈશ્વિક ઓપરેશનોનો એક માત્ર એવો પ્લાન્ટ છે જે Dodge Chargers (ડોજ ચાર્જર્સ), Dodge Challengers (ડોજ ચેલેન્જર્સ), અને Chrysler 300 (ક્રિસ્લર 300)નું ઉત્પાદન કરે છે.
- બ્રેમ્પટનમાં બનેલી 90 ટકા કારનો નિકાસ થાય છે જેનો મોટો ભાગ યુએસમાં જાય છે.

- બ્રેમ્પટનમાં ઓટોમોટિવ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં મેગ્ના (Magna), માર્ટિનરિઅ (Martinrea), એબીસી ટેકનોલોજીસ (ABC Technologies) અને અન્ય ઘણી કંપનીઓની માલિકીની સુવિધાઓ સહિત ઘણી મોટી કંપનીઓ છે.

સુવાક્યો

"બ્રેમ્પટન આપણી સ્ટેલાન્ટિસ સુવિધાના નેજા હેઠળ ઓટોમોટિવ ક્ષેત્રે ઉત્કૃષ્ટતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવે છે, જે આશરે 3,000 જેટલી સારા પગારધારી ઉત્પાદન ક્ષેત્રના રોજગાર પૂરા પાડે છે અને પ્લાન્ટ પર હોય એવી દર એક નોકરી દીઠ આપણા સમુદાયમાં અંદાજે પાંચથી છ અન્ય નોકરીઓ ઊભી કરે છે. વિદિત છે કે વૈશ્વિક ઓટોમોટિવ ઉદ્યોગ વિદ્યુત વાહનો તરફ વળી રહ્યો છે અને બ્રેમ્પટન – તેના વિશાળ અને ઇનોવેટિવ ઉન્નત ઉત્પાદન ક્ષેત્રને જોતા - આ પરિવર્તનનો ભાગ બને તે જરૂરી છે. હું ફેડરલ અને પ્રાંતીય સરકારોમાં અમારા ભાગીદારોને સ્ટેલાન્ટિસ સાથે તેમના બ્રેમ્પટન પ્લાન્ટમાં રોકાણ સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરવા વિનંતી કરું છું."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

બ્રેમ્પટનનું અદ્યતન ઉત્પાદન ક્ષેત્ર એ બ્રેમ્પટનના તમામ ઉદ્યોગોમાં સહયોગ, ભાગીદારી અને ઇનોવેશનનો પાયો છે, જે રોજગાર દ્વારા આપણા શહેરના સૌથી મોટા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે. એકલા સ્ટેલાન્ટિસ પ્લાન્ટમાં અને આપૂર્તિ શ્રૃંખલા દ્વારા જ 15,000 થી વધુ નોકરીઓ જળવાય છે તેવો લઘુત્તમ અંદાજ છે. બ્રેમ્પટનના ઓટોમોટિવલક્ષી ભવિષ્ય માટે સ્ટેલાન્ટિસની સુવિધામાં સુરક્ષિત રોકાણ કરવા આપણે સહુએ ભેગા મળી કાર્ય કરવાની જરૂર છે.

- માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros), રીજનલ કાઉન્સિલર, વોર્ડ 3 & 4; પ્રમુખ, ઇકોનોમિક ડેવેલપમેન્ટ, સીટી ઓફ બ્રેમ્પટન

"હાલમાં વિદ્યુત વાહનોની સુવિધાઓ માટે નિવેશના દીર્ઘકાલિક નિર્ણયો લેવામાં આવતા હોવાને કારણે સરકારના તમામ સ્તરે સાથે મળીને તે સુનિશ્ચિત કરવા કાર્ય થવું જોઈએ જેથી આપણે કોઈ તકો ચુકી ના જઈએ. સ્ટેલાન્ટિસ બ્રેમ્પટન એક પુરસ્કાર વિજેતા પ્લાન્ટ છે અને તે તેમના ઉત્પાદો માટે પ્રખ્યાત છે. અમારા ભાગીદારો સાથે કાર્ય કરીને અમને આશા બંધાય છે કે સ્ટેલાન્ટિસ બ્રેમ્પટન એસેમ્બલ પ્લાન્ટમાં સુરક્ષિત નિવેશ કરી શકાશે જેથી અમારા સ્થાનિક સમુદાયને અને કેનેડાના ઓટોમોટિવ ઉદ્યોગને લાભ થાય.

- પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 & 5; ઉપ પ્રમુખ, ઇકોનોમિક ડેવેલપમેન્ટ, સીટી ઓફ બ્રેમ્પટન

"નોર્થ અમેરિકન માર્કેટમાં તેની વ્યૂહાત્મક પહોંચ, ઉચ્ચ ગુણવત્તાવાળા કાર્યબળ અને પુરસ્કાર વિજેતા ઉત્પાદનને ધ્યાનમાં લેતા, શહેરના ઉન્નત ઉત્પાદન ક્ષેત્રને ટેકો આપવા બ્રમ્પટન વ્યૂહાત્મક રીતે સ્થિત છે. અમારી ઇકોનોમિક ડેવેલપમેન્ટ ઓફિસ બ્રમ્પટનના ઓટોમોટિવ ઉદ્યોગની ધરોહર સમા સ્ટેલાન્ટિસને ટેકો આપવો ચાલુ રાખશે – અને સાથે જ ઉન્નત ઉત્પાદન ક્ષેત્રમાં રહેલ કંપનીઓને જેથી આપણા સ્થાનિક અર્થતંત્રને લાભ થાય."

- રિચર્ડ ફોર્વર્ડ, આયુક્ત, પ્લાનિંગ એન્ડ ઇકોનોમિક ડેવેલપમેન્ટ, સિટી ઓફ બ્રમ્પટન

બ્રમ્પટન એસેમ્બલ ખાતેના યુનિફોર (unifor) સભ્યો દુનિયાના કેટલાક ઉત્કૃષ્ટ ગુણવત્તા ધરાવતા અતિ લોકપ્રિય વાહનો બનાવે છે અને અમારી સુવિધા ચાલી રહેલી ઉત્પાદ અધિકૃતિઓ અને નવા નિવેશો માટે સુસ્થિત છે. આ પ્લાન્ટ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તે આખા કેનેડાના ઓટો પ્લાન્ટ જે પડકારોનો સામનો કરે છે તેવા નથી જેમાં સામેલ છે તકવાદી વૈશ્વિક આપૂર્તિ શ્રૃંખલાઓ અને વિદ્યુતિકરણ તરફનું વલણ. અમને જાણ છે કે સક્રિય સરકારી ટેકા અને સમાજ પ્રવૃત્તતા અને કામગાર એકતા સાથે બ્રમ્પટનમાં ઓટો સેક્ટરનું ભવિષ્ય ઉજ્જવળ છે.

- ડેની પ્રાઈસ, પ્રમુખ, યુનિફોર લોકલ 1285

"વૈશ્વિક આપૂર્તિ શ્રૃંખલાઓમાં અમારો ઓટોમોટિવ સેક્ટર એક આગેવાન તરીકે ઉભરી આવે એવી અમારી સરકારની ઇચ્છા છે. આ હકિકતમાં બદલાય તે માટે અમે બનતું બધું જ કરી છુટીશું. સેક્ટરમાં અમારા ચાલુ રહેલા રોકાણો સાથે અમે એક મજબૂત અને ટકાઉ કેનેડિયન બેટરીની ઇકોસિસ્ટમ ઊભી કરી શકીએ તે માટે અમે વધુને વધુ તકો શોધવી ચાલુ રાખીશું અને હરિત સારા પગારવાળા રોજગાર ઊભા કરીશું. સ્ટેલાન્ટિસની બ્રમ્પટન એસેમ્બલ હંમેશા અમારે માટે ઉચ્ચતમ પ્રાથમિકતા ધરાવશે અને અમારી ટીમ આ સુવિધાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અથાક પરિશ્રમ કરવાનું ચાલુ રાખશે.

- એન્ડી ક્લિમોર, M.P., મિનિસ્ટર ઓફ ઇનોવેશન, સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંસદીય સચિવ

"બ્રમ્પટન ખાતેનો સ્ટેલાન્ટિસનો પ્લાન્ટ સમુદાય અને દેશ માટે પાયાનો પથ્થર છે. અમે તે વારસાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ કે કેનેડિયન ઉદ્યોગ અને ગતિશીલતા આગામી પેઢીને આગળ વધારી શકે.

- ફ્લેવિયો વોલ્પ, પ્રમુખ, ઓટોમોટિવ પાર્ટ્સ મેન્યુફેક્ચરર્સ અસોસિએશન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ



Media Release

કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca